

॥ ॐ ॥
॥ तस्य वाचकः प्रश्नवः ॥

ऋग्भूतभिरा

ऋग्भूतभिरा एटले अनुभवयुक्त सत्यथी भरेलुं
बहुजनहिताय - बहुजनसुखाय

मुक्ता

पातंजल योगदर्शन - समाधिपाद

- योगभिक्षु

पातंजल योगदर्शनना समाधिपादना योवीसथी ओगणत्रीसमा सूत्रमां ईश्वरनी व्याख्या करेले छे अने ईश्वरनी ओणभ आपेल छे.

ईश्वरशरणागतिथी असंप्रेक्षात योगनी प्राप्त थाय छे. ईश्वरने शरणे जवुं होय तो ईश्वरनी ओणभ प्राप्त करी लेवी जोईअ. पतंजलिमुनिए ईश्वरनी व्याख्या करतां कह्युं के -

क्लेश, कर्म, कर्मफल अने वासना जेमां नथी ते विशेष येतन ईश्वर छे. जेओ आ चारेयथी नित्यमुक्त छे तेओ ईश्वर छे. ईश्वर संपूर्ण सर्वज्ञ छे. ईश्वर पूर्वकाणना गुरुओना पण गुरु छे अने काणथी छेठाउंडी शकाता नथी. ईश्वरनो वाचक - ईश्वरनुं नाम प्रश्नव (ओम्=ॐ) छे. प्रश्नवनो सार्थ जप करवो.

समाधिपादना सूत्र २४ थी २८ मां आवती आ व्याख्याने आपणे खूब विस्तारपूर्वक समज्या छीअ. अर्थनी भावना साथे ओम्नो जप करवाथी शुं फण मणे छे ए वात ओगणत्रीसमा सूत्रमां कहे छे.

ततः प्रत्यक्ष येतनाधिगमोऽप्यन्तराया भावश्च ॥२८॥

भावार्थ- तेनाथी (ओम्नो सार्थ जप करवाथी) प्रत्यक्ष येतनानो (ज्ञात्मानो) साक्षात्कार थाय छे अने अंतरायोनो अभाव थई जाय छे.

विस्तार- ओम्नो सार्थ जप एटले ओम्ना अर्थना स्मरणपूर्वकनो जप-चित्तन - मननपूर्वकनो जप. मनुष्य जेनुं खूब चित्तन करे छे तेना स्वरूपनुं तेने ज्ञान थाय छे. ईश्वरनुं खूब चित्तन करनारने पण ईश्वरना स्वरूपनी ओणभ थाय छे. ईश्वरनी-परमात्मानी ओणभ थवाथी आत्माना-ज्ञात्माना जुलाई-२००८

स्वरूप विषेनी पण साची समज प्राप्त थाय छे. कारणाके आत्मा अने परमात्मामां येतनना संबंध अकपाशुं छे, येतनधर्मे बने सजातीय छे. तेथी परमात्मानुं ज्ञान थतां अंतरात्मानुं ज्ञान पण थई जाय छे.

आत्मा-परमात्माना परम आनंददायक तत्वज्ञानने प्राप्त करनारने पछी विश्व बहुं अनाकर्षक भासे छे; तेने पछी विश्वना पदार्थोमां रस रहेतो नथी. अने तेथी तेना ज्ञवनमां लाभ-हानि जेवुं पण कांઈ बचतुं नथी. जेने लाभ-हानि जेवुं कांઈ ना होय तेने हर्ष-शोक जेवुं पण क्यांथी होय? जेना हर्ष-शोकनो नाश थई गयो होय तेना ज्ञवनमां अंतरायो रहे शाना आधारे? तेनां विष्णो-अंतरायो-विक्षेपो बहुं ज समाप्त थई जाय छे. जेम सूर्योदय थतां ज अंधारुं भागी जाय छे तेम परम येतन्यनो स्पर्श थतां ज जड अेवा भ्रमो-अंतरायोनो अभाव थई जाय छे. योगसाधनामां क्या क्या अंतरायो आवे छे ते हवे कहे छे.

व्याधिस्त्यान संशय प्रभादालस्याविरति-
भ्रांतिदर्शना लभ्यभूमिकत्वानवस्थितत्वानि
चित्तविक्षेपास्तेन्तरायाः ॥ ३० ॥

भावार्थ- व्याधि, स्त्यान, संशय, प्रभाद, आलस्य, अविरति, भ्रांतिदर्शन, अलभ्यभूमिकत्व अने अनवस्थिततत्त्व; आ नव अंतरायो चित्तने विक्षेप करनारा छे.

विस्तार- आगणना सूत्रमां कह्युं के ओम्ना सार्थ जपथी अंतरायोनो अभाव थई जाय छे. तेथी

અંતરાયો કેવા છે તેની થોડી વાત અહીં ચર્ચા છે. નવે અંતરાયોનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ.

જીવનસાધનામાં અને યોગસાધનામાં જે અંતરાયો આવે છે. તે મુજ્જ્ય નવ છે. તેને સારી રીતે સમજ્ઞાએ. કારણકે અંતરાયો દૂર ના કરી શકીએ તો સાધના થઈ શકે નહીં. જીવન માટે પણ સાધના શબ્દ વપરાય છે. જીવન પણ એક સાધના છે. કોઈ કહેશે કે “અમારે કયાં મોક્ષ મેળવવો છે, કે સાધના કરવી છે તે અંતરાયો આવવાના હતા! અને અંતરાયો ના આવે તો તેને દૂર કરવા માટે ઓમ્ભ્રનો જ્યુ કરવાની શી જરૂર છે?” તો તેનો ખુલાસો આ પ્રમાણે છે.

જીવન પણ મહાન સાધના છે. યોગ, જીવન માટે છે. તેથી શાંતિમય જીવન જીવવું હોય, મનુષ્યજન્મ સાર્થક થાય તે રીતે જીવન વ્યતીત કરવું હોય, તો સાધનામય જીવવું પડશે, જીવનને પણ સાધના બનાવવી પડશે. જીવનનું નામ ‘યોગ’ ભલે ના આપીએ પણ તે યોગ જ છે. જો સુખશાંતિપૂર્વક જીવવું હશે તો યોગની રીતે જ જીવવું પડશે. તેથી જીવન પણ સાધના બની જશે. જો જીવન સાધના બની જાય તો જીવનસાધનામાં અંતરાયો આવશે જ. અને તો અંતરાયોને દૂર કરવા માટે ઓમ્ભ્રનો જ્યુ પણ કરવો પડશે. માટે અંતરાયોને વિશદૃપે સમજવા જોઈશે. આપણે ભલે યોગ ના સાધવો હોય, નિરાંતે જીવન જ જીવવું હોય પણ જો તેમાં વ્યાધિ આવે તો શું કરીએ? આપણે કોઈ રોગ-વ્યાધિને ઈચ્છાએ છીએ? ના. તો વ્યાધિને દૂર કરવા માટે ઓમ્ભ્ર નો જ્યુ કરવો જોઈએ. આપણે સૌ વ્યાધિને સારી રીતે જાણીએ છીએ.

વ્યાધિ- વ્યાધિના-રોગના અનેક પ્રકાર છે. તે બધા તન મન અને ભ્રમ નામના ત્રણ પ્રકારમાં આવી જાય છે. ટી.બી., કેન્સર, તાવ, ખસ, ખરજવું વગેરે અને સાધ્ય-અસાધ્ય કોટીમાં આવતા રોગ તનના છે. તનના રોગ શરીરને ખૂબ ત્રાસ આપે છે. નિરોગીપણાને પહેલું સુખ કર્યું છે. તેથી “પહેલું સુખ તે જાતે નર્યા” એમ કહેવાય છે. તનના રોગ ટાળવા આપણે દવાનો તથા ડૉક્ટર-વૈદ્યનો આશરો લઈએ છીએ.

તન નિરોગી હોય પરંતુ મન નબણું પડી જાય જુલાઈ-૨૦૦૭

તો તે મનનો રોગ છે. નબળા મનવાળાને સતત એવા જ વિચારો આવ્યા કરે છે કે હું બીમાર છું, હું અશક્ત છું, મને કોઈક કાંઈક કરી નાખ્યું છે. આમ સતત તે નિરાશામાં અને નિરુત્સાહમાં જ આગોટો રહે છે. તેના સંગમાં જે આવે છે તેને પણ તે નિરાશાના સાગરમાં જ ઝૂબકાં ખવડાવવાનો પ્રયત્ન કરે છે. મનના રોગો માટે લોકો માનસિક-મનોવૈજ્ઞાનિક વિશેષજ્ઞોનો આશરો લેતા હોય છે. તન કરતાં મનનો રોગ સૂક્ષ્મ છે.

તન, મન નિરોગી હોય પરંતુ મનુષ્ય જ્યારે ભ્રમમાં, વહેભ્રમમાં, અજ્ઞાનમાં ફ્સાય છે ત્યારે તે પણ એક રોગી જ ગણાય. તેથી ભ્રમવાળાને ભ્રમનો રોગી જ કહી શકાય. ભ્રમનો રોગી અસ્વાભાવિકપણે અને ખોટી-ભભિત માન્યતાઓમાં જ જીવતો હોય છે. તેનું મગજ વિપરીત વિચારથી જ ખદબદ્ધ હોય છે, તેથી તે સામાન્ય જનસમુદ્દાય સાથે તાલમેળ સાધી શકતો નથી, અને તેથી તેને એકલતાના દુઃખનો પણ સામનો કરવો પડે છે. તન અને મનના રોગ કરતાં ભ્રમનો રોગ વધુ સૂક્ષ્મ અને ગૂંઘવણાલ્યો છે. ભ્રમરોગમાંથી મુક્ત કરવા માટે ખૂબ અનુભવી અને ધીરજવાળા મહાપુરુષની જરૂર પડે છે.

તનના, મનના અને ભ્રમના રોગો થવાનાં કારણોમાં મુજ્જ્ય કારણ વાત્સલ્યપ્રાપ્તિનો અભાવ છે. તેથી દરેક પ્રકારના ઉપચારકે દરદીનો પ્રથમ ઉપચાર તેને વાત્સલ્ય આપીને કરવો જોઈએ. વાત્સલ્ય મળવાથી રોગ ઓછા થાય છે, થયેલા રોગ શીધી મટે છે અને રોગના દુઃખને સહન કરવામાં ખૂબ ટેકો મળે છે. દરદીએ પણ રોગકાળો તપની ભાવના રાખીને રોગ-દુખને સહન કરી લેવું જોઈએ. શીર્ષાસન કરતી વખતે શરીરને ઘણું કષ્ટ પડે છે, પરંતુ તે વખતે “હું વ્યાયામ કરી રહ્યો છું” એવી ભાવના હોવાના કારણો શીર્ષાસનનું કષ્ટ ‘કષ્ટ’ નથી લાગતું. વળી જેમ નિરોગતાનો સમય પૂરો થતાં રોગ આવ્યો તેમ રોગાવસ્થાનો સમય પૂરો થયે નિરોગતા આવવાની જ. અસાધ્ય રોગમાં પણ હાયવોય કરીને દુઃખને વધારી મૂકવું ના જોઈએ. તાત્ત્વિક દાખિલાએ જોતાં મૃત્યુ એ તો કુદરત તરફથી કાયાકલ્પની બદ્ધિશ છે. આવતા જન્મે કેવું નવુંક્રોર શરીર મળે છે! અસાધ્ય રોગમાંથી મુક્ત

થવા, આયુષ્ય પુરું થયે, અસાધ્ય રોગવાળા શરીરને છોડવું જ રહ્યું. “મૃત્યુ એ તો જૂના અને રોગી શરીરને છોડીને નવા અને નિરોગી શરીરને પ્રાપ્ત કરાવવાવાળી કુદરતની કરુણામાત્ર છે.” જો એવી સમજણ ખરેખર થઈ જાય તો કેટલી રાહત થઈ જાય! ટૂટી-કૂટી ઝૂંપડીમાંથી નવાનકોર બંગલામાં રહેવાનું થાય તો કેટલો આનંદ થાય છે! પણ આવી સાચી સમજણ થાય તો ને? ઓમ્પ્રરમાત્મા આપણાને સૌને સાચી સમજણ આપે તેવી પ્રાર્થના. અસ્તુ.

ઉપરોક્ત ત્રણે પ્રકારના રોગોનો વ્યાધિમાં સમાવેશ થઈ જાય છે અને વ્યાધિને ચિત્તવિક્ષેપ કરનાર અંતરાય ગણ્યો છે. અને આ અંતરાયનું નિવારણ કરવા માટે પણ એકત્ત્વના અત્યાસનો આગ્રહ યોગશાસ્ત્ર કરી રહ્યું છે.

સ્ત્યાન- મનમાં ખોટું કરવાના સંકલ્પો ઊઠે, ખરાબ વર્તન કરવાના વિચારો આવે અથવા તો મનન્યિત ચેષ્ટા રહિત થઈ જવાના વિચારો કરે, કર્મરહિત થવાના, પ્રમાદી થઈ જવાના સંકલ્પો આવ્યા કરે તેના માટે યોગશાસ્ત્રમાં સ્ત્યાન શર્દું વાપર્યો છે. મન ખોટાં કર્મો કરવાના વિચારો કર્યા કરે પણ તે પ્રમાણે કરી ના શકે ત્યારે પરિતાપ ભોગવે છે; અથવા તો કર્મરહિત થઈ જવાના, પ્રમાદી થઈ જવાના વિચારો કર્યા કરે પણ કર્મરહિત કાંઈ થોડું થઈ શકાય છે! મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે તે સતત કર્મરત રહ્યા કરે છે. કર્મ વિના મનુષ્ય ગાંડા જેવો થઈ જાય. જે મનમાંકડાને સત્તપ્રવૃત્તિમાં ના રોકવામાં આવે તો તે અસત્તપ્રવૃત્તિએ ચડી જવાનું. તેથી વિચારવંતો કહે છે કે “બેકારસે બેગાર ભલી” એટલે કે ભલે કંઈ લાભ થવાનો ના હોય તો પણ કર્મભય-પ્રવૃત્તિમય રહેવું. નહીં તો “નવરો બેઠો નખ્ખોં વાળો” તે કહેવત સફળ થાય.

સંશય- સંશય શર્દું અતિ પ્રચલિત છે. શંકાઓ કરવી - સંશયો થવા કે આપણે યોગ વિષે જે કાંઈ સાંભળીએ છીએ તે સાચું હશે કે ખોટું હશે? આપણે જે સાધના કરીએ છીએ તેનાથી જે ફળપ્રાપ્તિ કહી છે તે થશે કે નહીં તેવી શંકા-કુશંકાઓ થયા કરે તે પણ એક અંતરાય છે.

જુલાઈ-૨૦૦૭

“સંશયાત્મા વિનશ્યતિ” અર્થાત્ જે સંશયી છે તેનો છેવટે નાશ થઈ જાય છે. કારણકે સતત સંશયો રહ્યા કરે તો કોઈનું સાચું મનાય જ નહીં. ગુરુનું, શાસ્ત્રનું, આપું પુરુષોનું, સંતોનું કે વડીલોનું સાચું લાગે જ નહીં. બધામાં શંકાઓજ રહ્યા કરે. અને જ્યાં સુધી શંકાઓ જ રહ્યા કરે, બધું ખોટું જ લાગે ત્યાં સુધી આચરણ કેવી રીતે કરી શકાય? અને આચરણ ના કરી શકાય તો ફળની પ્રાપ્તિ ક્યાંથી થાય? અને ફળ ના મળે તો વિનશ્યતિ જ, અર્થાત્ નાશ જ થઈ જાય.

જે કાંઈ પણ સદ્ગર્ભની સાધના કરી ના શકાય તો સદ્ગ્રણ મળે ક્યાંથી? કેવલ્યની- મોક્ષમુક્તિની પ્રાપ્તિ કરીને મનુષ્યજન્મની સાર્થકતા કર્દ રીતે થાય? પણી મનુષ્યજન્મ એળે જ જાય. મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને મનુષ્યજન્મની સાર્થકતા કરવાનાં જે કર્મો હતાં તે ના થયાં અને સામાન્ય મનુષ્ય અને પશુપક્ષીની જેમ જ જીવા. જેમ પશુપક્ષીઓ આહાર, નિદ્રા, ભય અને મૈથુનમય થઈને જ પોતાના જીવનને વ્યતીત કરી નાખે છે તેમ જીવનને વેડફી નાખ્યું. પશુપક્ષીઓની યોનિમાં જે સાધના નથી કરી શકતી તે-તેવી સાધના કરીને મનુષ્યજન્મની સાર્થકતા કરી લેવાની હતી, કે જેથી પુનર્જન્મના ત્રાસમાંથી છૂટી જવાય; કેવલ્ય મેળવી લેવાનું હતું કે જેથી ગર્ભમાં આવીને ઉંઘે માથે લટકવું ના પડે અને માતાના ગર્ભશયમાં- ગંદા સ્થાનમાં અનેક વ્યથાઓ ભોગવવી ના પડે. એવી એક (કેવલ્યની- મોક્ષની) પ્રાપ્તિ કરી લેવાની હતી કે જેથી ફરીફરીને ચોર્યાશી લાખ યોનિમાં ભટકવું ના પડે, ચોર્યાશી લાખ વખત માતાના ગર્ભમાં આવવું ના પડે અને ચોર્યાશી લાખ વખત ભયંકર પરિતાપ ભોગવવો ના પડે. તે બધામાંથી મુક્તિ મેળવી લેવાની જે યુક્તિ હતી તે પ્રાપ્ત ના કરી એટલે વિનશ્યતિ જ થયાને? “પુનરપિ ભરણમ્ પુનરપિ જનમ્ પુનરપિ જનની જઠરે શયનમ્” રૂપી રહેટ? ઉપર ચડી ગયા એટલે વિનશ્યતિ ના થયા તો શું થયા? તેથી કહું કે સંશયાત્મા વિનશ્યતિ. યોગસાધનમાં શંકા- કુશંકાઓ થયા જ કરે એ પણ એક અંતરાય છે. અસ્તુ. કમશા:

(પ.પૂ.ગુરુદેવશ્રી યોગભિક્ષુજ રચિત
“મુક્તા”પુસ્તકમાંથી સાભાર)

પ.પુ.ગુરુદેવનાં આશિર્વચન - ટેલીફોન પર

તાલીમકેન્દ્ર-માણિનગર

-પ્રવિષાભાઈ શાહ

કર્મનો અટલ નિયમ

તા. ૨૬-૩-૨૦૦૮

સત્ય ધર્મ ગુરુદેવકી જ્ય. સત્ય અને ધર્મ એજ આપણા ગુરુદેવ, અને એમની જ્ય તો જ આપણી જ્ય.

સૌનું સ્વાગત, હાર્દિક જ્યનારાયણ. બહુ આનંદની વાત છે કે તમે સૌ મનુષ્ય જન્મ સાર્થક કરવાનો પ્રયત્ન કરો છો. આજે આપણો કર્મના સિદ્ધાંતની થોડીક વાત કરીએ. કોઈ આપણને થપ્પડ મારે કે ગાળ આપે, આપણો તેને સામે ગાળ આપીએ-થપ્પડ મારીએ, એટલે હિસાબ- કિતાબ ચૂકે થઈ જાય. કર્મ બંધાવાની કે ફળ મળવાની કોઈ ચિંતા નહીં. પણ કેટલીકવાર એવું પણ બને કે આપણો કોઈક ને થપ્પડ મારીએ કે ગાળ આપીએ તો તે ચુપચાપ સહન કરી લે, પ્રતિકાર ના કરે, સામનો કરવાની તેનામાં ક્ષમતા ન હોય. એટલે લાચારીવશ મૂંગે મોકે સહન તો કરી લે પણ બદલાની ભાવનાનું બીજ તેના મનમાં રોપાઈ જાય. કર્મના સિદ્ધાંત મુજબ વખત આવે આપણને એક થપ્પડ ની સામે સો થપ્પડ ખાવાનું દુઃખ - કષ્ટ મળે જ. આમ બે પ્રકારના માણસોની આપણો વાત કરી. પણ સંસારમાં કેટલાક સંતચરિતુ, ભક્તજન કે

સાધુ જેવું જીવન જીવનારા માણસો પણ હોય છે. આપણો તેઓનો અનાદર કરીએ, તેમના તરફ અયોગ્ય વર્તન કરીએ તો પણ તેઓ આપણને માફ કરી દે છે. બદલાની કોઈ ભાવના જ તેઓના મનમાં ઉદ્ઘભવે નહીં. તેઓનો સ્વભાવ જ એવો ઉદાર અને કલાણાસભર હોય છે. પરંતુ કુદરત તો કુદરત નું કામ કરે જ! એના ચોપડે તો એ કર્મની નોંધ થાય જ! જેમ આપણો કોઈનું ખૂન કરી નાખીએ અને સામોપક્ષ કદાચ આપણને માફ કરી દે, પણ સરકાર તો શિક્ષા કરે જ છે. એમ કોઈ સંતચરિત કે સાધુચરિત વ્યક્તિ ભલે આપણને માફ કરી દે પણ કુદરત તો આપણને માફ ના જ કરે. કર્મ નો સિદ્ધાંત અફર છે, અકળ છે, અને એટલે જ કુદરત એ કર્મનું ફળ હજાર ગણું કરી ને પાછું વાળો છે. જેમ કે એક ઘણું દાન હજાર ગણું પુણ્ય!

તો કર્મના સિદ્ધાંતોને ઊંડાશપૂર્વક સમજવાનો સૌ પ્રયત્ન કરજો. સૌને જ્ય નારાયણ.

વિજળીના ઝબકારે

તા. ૨૯-૪-૨૦૦૮

સત્યધર્મ ગુરુદેવ કી જ્ય. સત્ય અને ધર્મ એજ આપણા ગુરુદેવ અને એમની જ્ય તો જ આપણી જ્ય. સૌનું સ્વાગત, અભિનંદન, આશિષ. આપણો અવારનવાર કહીએ છીએ કે વિજળીના ઝબકારે મોતીડાં પરોવી લઈએ. જે વખતે સત્કર્મ કરવાનો વિચાર મનમાં આવે કે તરત જ તેનો અમલ કરી લેવો જોઈએ. એના માટે રાહ નહીં જોવાની, આણસ નહીં કરવાની. માણસનું મન એટલું બધું ચંચળ છે કે મનમાં તો વિચારોનું ધમસાણ સતત ચાલતું જ હોય છે. સારો વિચાર આવી ને ક્યાંય લુપ્ત પણ થઈ જાય. માટે સારું કામ કરવાની હચ્છા થાય. ત્યારે તે તરત જ કરી લેવું જુલાઈ-૨૦૦૮

જોઈએ. વીજળીના ઝબકારે મોતી પરોવાઈ જાય એવી તૈયારી રાખવી જોઈએ. એટલી જાગૃતિ મનની હોવી જોઈએ.

યોગ-શાસ્ત્રમાં કહ્યું છે ને કે સંસારનાં બધાં સુખો દુઃખની પ્રતીક્ષિયાવાળાં છે. મોકશનું સુખ જ એક એવું સુખ છે કે જેની પ્રતિક્ષિયા દુઃખ નથી. સંસારમાં રહીએ છીએ એટલે દુઃખો પણ આવશે. અને સુખો પણ આવશે. ખાવું- પીવું- નોકરી ધંધો- બાળબચ્ચાં એ બધું તો જીવન જીવવામાં સહાયરૂપ થઈ શકે એટલાં પૂરતું બરાબર છે. પણ આપણું મુખ્ય લક્ષ્ય તો મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો એ છે. એવું સુખ પ્રાપ્ત કરવાનો

પ્રયત્ન કરવો જોઈએ કે જેની પ્રતિક્રિયા દુઃખ ના હોય, મોક્ષની પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરતા રહીએ. એના માટે સત્કર્મા કરતા રહીએ. સત્કર્મા કરવાની નવી નવી તક ઊભી કરતા રહીએ.

તમે સૌ આ બધી વાતો સારી રીતે સમજો છો તેનો અમને આનંદ છે.

આજે ધર્મમેઘમાં તો માણસોની - ભક્તોની અવરજવર આખો દિવસ સતત ચાલતી જ રહી.

શશીકાન્તભાઈ એમના લગ્નની તિથિ નિમિત્તે પગે લાગવા આવ્યા હતા. જન્મદિવસ નિમિત્તે નૈષધભાઈ સહકૃતુંબ આવ્યા હતા. મુમક્ષાબેન પણ બાબાની વર્ષગાંડ નિમિત્તે સહકૃતુંબ પગે લાગવા આવ્યા હતા. ખુરશી - રીપેરિંગ કરવાવાળા ભાઈઓ પણ આવ્યા હતા. રવિવારનો સાંજનો સ્વાધ્યાય સત્સંગ પણ થયો અને એમ આખો દિવસ ક્યાંય પસાર થઈ ગયો. અસ્તુ. સૌને જયનારાયણ.

સત્તુ સાહિત્ય પ્રચારપત્રિકા

-યોગભિક્ષુ

ગુરુકૃપાને લઘુકૃપા ન બનાવી દઈએ!

(સત્તુ સાહિત્ય પ્રચારપત્રિકા નં-૭૧)

(તા. ૧૮/૫/૨૦૦૧ના રોજ લાલગેભી આશ્રમ, હાથીજણમાં, પૂજ્ય મુક્તાબાની પુષ્ટિનિષ્ઠ નિમિત્તે રખાયેલ યજ્ઞમાં, પૂજ્ય શ્રી યોગભિક્ષુજીએ જે આશીર્વચન આપેલાં તેનો ઢૂક સાર)

ધાર્ણાં વર્ષે બે ગુરુભાઈઓ મળ્યા. એક કહે કે હું ખૂબ સુખી હું, મારા પર સંપૂર્ણ ગુરુકૃપા છે. એ સાંભળીને બીજો કહે કે પણ અમારા ઉપર ગુરુકૃપા ક્યારે થશે?

ખરેખર બંને સુખી હતા પણ એક પાસે ગુરુકૃપા જોવાની દર્શિ હતી અને બીજા પાસે એવી દર્શિ નહોતી. તેથી તેને એ પ્રશ્ન થતો હતો કે અમારા ઉપર ગુરુકૃપા ક્યારે થશે?

લોકોએ ગુરુકૃપાની વ્યાખ્યા કેટલી બધી હીછરી અને સસ્તી બનાવી દીધી છે! ગુરુકૃપાને પણ ભૌતિક કામનાઓ પૂર્ણ કરવાનું એક સાધન જ માની લીધું છે!

પરમ ગુરુ તો માત્ર પરમાત્મા એક જ છે કે જેમનું મુખ્ય નામ ઓમ્ છે જેમના દ્વારા આપણને આવું ગૃહ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમને પણ આપણે ગુરુ-સદ્ગુરુ કહીએ છીએ. ગુરુકૃપા થાય ત્યારે જીવ, જગત અને જગદીશ્વર વગેરે બધું સાચા સ્વરૂપે સમજાય. શરીરધારીને સુખદુઃખ તો વતાઓણા પ્રમાણમાં અનિવાર્યપણે આવવાનાં જ. સુખદુઃખને સમાન ભાવે ભોગવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું બધું જ્ઞાન પ્રાપ્ત થાય અને તેનું જીવનમાં આચરણ કરી શકાય તો તેને ગુરુકૃપા થઈ કહેવાય.

જેમ ફૂતરાને બે બટકાં રોટલી નાંખીએ એટલે જુલાઈ-૨૦૦૮

તે પૂછુંદી પટપટાવવા લાગે છે અને તેને બે બટકાં ન મળે તો ડાઉ - ડાઉ કરીને ભસવા લાગે છે તેમ સામાન્ય મનુષ્યને થોડીક ભૌતિક સુખ - સગવડ પ્રાપ્ત થાય એટલે તે આનંદથી ઊછળી-ઊછળીને કહેવા લાગે છે કે મારા ઉપર પૂર્ણ ગુરુકૃપા થઈ; અને તેનાં થોડાંક સુખ-સગવડ નાશ પામે છે, કે જે સુખ-સગવડ હોય તે ખૂબ વધે નહીં તો તે કહેવા લાગે કે મારા ઉપર ગુરુકૃપા નથી, ક્યારે થશે?

ગુરુકૃપા દ્વારા શું આપણે બે બટકાં રોટલી જ મેળવવી છે? તે તો આપણે આપણા પોતાના પ્રયત્નથી મેળવી જ રહ્યા છીએ; તે તો પશુ-પક્ષીઓને પણ મળે જ છે. આપણે તો એવું અમૂલ્ય કાંઈક મેળવવું છે જે આપણે જન્મો સુધી પ્રયત્ન કરીએ તોપણ મેળવી શકતા નથી. પુનઃ પુનઃ શરીર ધારણા ન કરવું પડે એવું અણમોલ જ્ઞાન ગુરુસંતો પાસેથી મેળવવાનું છે અને તેમની છત્રછાયામાં રહી તે જ્ઞાનનું આચરણ કરીને જન્મ-મરણાની મહા જંજાળમાંથી હંમેશા માટે મુક્ત થઈ જવાનું છે, મોક્ષ - મુક્તિ - કેવલ્ય પ્રાપ્ત કરી લેવાનું છે.

ગમે તેટલાં સુખ-સગવડ પ્રાપ્ત હશે તોપણ શરીરધારીને દુઃખો તો આવવાનાં જ. માતાના ગર્ભમાં પ્રવેશથી માંડિને મૃત્યુ સુધીની સિથિતિને સૂક્ષ્મ રીતે જો અવલોકી જઈએ તો જરૂર ખ્યાલ આવશે કે કેટલાં બધાં પ્રલયંકારી દુઃખોમાંથી જીવને પસાર થવું પડે છે. એ બધાં દુઃખો, ત્રાસો, વિટંબણાઓનો; પરિતાપો, ધર્મસંકટો, ઊથલપાથલોનો અને આસમાની-

સુલતાનીઓનો ચિતાર જો આપણાં કલ્યાણચું સમક્ષ ખડો કરી શકીએ - જોઈ શકીએ તો તરત ધૂજી જઈએ - મૂર્છિત થઈ જઈએ. એ અગણિત અનંત હૃદ્ભોના દરિયામાંથી, રૌ-રૌ નર્કમાંથી કાયમી છુટકારો પ્રાપ્ત કરવા માટે, સનાતન સુખને મેળવવા માટે મોક્ષ એક જ પરમ સાધન છે. મોક્ષ એટલે શરીર જ ધારણ ન કરવું પડે તેવી સ્થિતિ. જો શરીર ધારણ કરીએ તો સુખ-હૃદ્ભોન, એ તેના ધર્મો તો સાથે આવવાનાં જ. બધાં જ સુખનોની પ્રતિક્રિયા હૃદ્ભોન છે. માત્ર મોક્ષ જ એક એવું સુખ છે કે જેની પ્રતિક્રિયા જ નથી. આવી પ્રતિક્રિયા વગરના સુખને પ્રાપ્ત કરવાની યુક્તિ-પ્રયુક્તિઓ પ્રાપ્ત થાય અને તે મુજબ આચરણ કરવા લાગીએ તેને કહેવાય ગુરુકૃપા પ્રાપ્ત થઈ.

ગુરુકૃપા દ્વારા સાર-અસારના, નિત્ય-અનિત્યના વિવેકને યથાર્થરૂપે સમજીએ, કામ, કોધ, મદ, લોભ, મોહ, મત્સર વગેરેને તો આપણો સમજીએ જ છીએ, તે તો આપણામાં રૂંવાડે-રૂંવાડે વ્યાપેલા છે જ છે. તે બધાથી પર થઈ જવા માટે ગુરુકૃપાની જરૂર છે. મનુષ્ય-પ્રયત્નની હદની બહારનું જ છે તેને પ્રાપ્ત કરવા માટે ગુરુકૃપાની આવશ્યકતા છે.

ભારતના વડાપ્રધાન આવીને કહે કે મારો એક દિવસ હું તમને આપું છું, તમારે મારી પાસેથી જે કાંઈ કામ લેવું હોય તે લ્યો. આપણો વિચારીએ કે મારે રોજ ઘર સાફ કરવાનું, રાંધવાનું, કપડાં ધોવાનું વગેરે કામ કરવું પડે છે, તો તે બધું કામ વડાપ્રધાનને સોંપું તો એક દિવસ તો આરામ મળે. તેથી તે કામ તેમને સોંપું. તેમણે તે કર્યું. દિવસ પૂરો થયો અને તેઓ ચાલ્યા ગયા. પછી આપણી એની એ જ હાલત, ધારીના બળદ જેવી. વડાપ્રધાન તો એવું અને એટલું આપી શકે તેટલા શક્તિશાળી હતા કે જેથી આપણા કાયમનાં મહેનત-મજૂરી છૂટી જાત. પણ આપણો તો કંચનના બદલે કાંચ માંગ્યો તો વડાપ્રધાન શું કરે? આપણો પણ ગુરુકૃપા દ્વારા વાસનાઓ-કામનાઓ રૂપી કાચ જ માંગીએ તો ગુરુકૃપા શું કરે?

સત્યનારાયણની કથામાં આવે છે કે સાધુ-વાણીયો ધન કમાઈને વહાણમાં પોતાના દેશ આવતો હતો. ત્યાં અધવચ્ચે જ તેના વહાણમાં એક સંત પ્રગટ થયા અને પૂછવા લાગ્યા કે તારા વહાણમાં શું ભર્યું છે? વાણીયો ધનના કેફમાં છકી ગયો હતો તેથી તે એટલો પણ વિચાર ન કરી શક્યો કે દરિયાની અધવચ્ચે વહાણમાં કોણ પ્રગટ થઈ શકે? તેથી તેણે ઉડાઉ જવાબ આપ્યો કે મારા વહાણમાં તો ફક્ત વેલા અને પાંદડા

જુલાઈ-૨૦૦૭

જ ભર્યા છે. સંતરૂપે પ્રગટ થયેલા ભગવાને કહ્યું કે તથાસ્તુ, અર્થાત્ તેમ થાઓ. તેથી વહાણમાં જે કાંઈ હતું તે બધું વેલા-પાંદડામાં ફેરવાઈ ગયું. આમ, મનુષ્ય પણ અવારનવાર મૂર્ખાઈ કરતો હોય છે. બધી સુખસગવડ હોવા છતાંય ગુરુકૃપા નથી, ગુરુકૃપા નથી તેમ કહ્યા કરે છે. પછી ગુરુકૃપા કહેશે કે તથાસ્તુ, તો? મનુષ્યે થોડુંક તો બુદ્ધિશાળી થવું જોઈએ ને?

ગુરુકૃપા એટલે લધુકૃપા નહીં; ભારે કૃપા, મહત્વની કૃપા, પરમ કૃપા. પરમ કૃપા કોણ કરી શકે? કે જે પરમ હોય તે. પરમાત્મા પરમ છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે -

(૧) કલેશ, કર્મ, કર્મશય વગેરે જેમાં નથી તેવું વિશિષ્ટ ચૈતન્ય ઈશ્વર છે. (૨) ઈશ્વર સંપૂર્ણ સર્વજ્ઞ છે. (૩) ઈશ્વર ત્રિકાલીન ગુરુઓના પણ ગુરુ છે. (૪) ઈશ્વરનું નામ પ્રણાવ-ઓમ્ છે. (૫) ઓમ્ભૂમંત્રનો જપ અર્થની ભાવના સાથે કરવો. (૬) તેથી ચૈતન્યનો સ્વાનુભવ અને અંતરાયોનો અભાવ થાય છે.

આવી આવી સાચી, ગૂઢ, રહસ્યમયી, કલ્યાણદાયી તારનારી વાતો અને સમજણોને; આપણને ખૂબ પ્રેમથી જેઓ સમજાવે છે તેમને પણ આપણે ગુરુ કહીએ છીએ, ગુરુ માનીએ છીએ, માનવા જ જોઈએ.

આપણી બેદરકારીના કારણે ગુરુ, લધુ ન બની જાય અને ગુરુકૃપા, લધુકૃપા ન બની જાય તે માટે સાવધાન રહીએ.

હે પરમગુરુ પ્રાણવપરમાત્મા, આજે ગુરુપૂર્ણિમાના પરમપાવિત્ર દિવસે અમારી આપને પ્રાથીના છે કે અમે સૌ ગુરુકૃપાને ગુરુકૃપા તરીકે જ સમજ શકીએ તેવી કૃપા કરશો.

કદાચ આપણને એવો વિચાર આવે કે મોક્ષમાં તો શરીર જ ન હોય, તો પછી સુખનો અનુભવ શાનાથી થાય? આ પ્રશ્નનો જવાબ તો આપણાને રોજ મળી જાય છે. રાત્રે સ્વખમાં આપણો કેવા કેવા અલૌકિક અનુભવો કરીએ છીએ? તે વખતે સ્થૂળ શરીર તો પથારીમાં પડ્યું હોય છે તોય બધા વિષયોના અનુભવ થાય છે! જાગૃત અવસ્થામાં જે અનુભવ ન કરી શકીએ તેવા ઊડવા વગેરેના અનુભવો પણ સ્વખમાં થાય છે. આ સ્વખમાં થતા અનુભવો વખતે શરીર કે ઈન્દ્રિયો કોઈ જ સક્રિય હોતાં નથી તોય થાય છે. તો મોક્ષાવસ્થામાં સુખના, આનંદના અનુભવો કેમ ન થાય? મોક્ષ, સ્વખ કરતાં ઘણી ઊંચી, અલૌકિક, દિવ્ય અવસ્થા છે.

૩૦ ભગવાન હવે ક્યારે અવતાર લેશો?

(સત્તુ સાહિત્ય પ્રચારપત્રિકા નં-૭૧)

આપણા સૌના મનમાં એ પ્રશ્ન અવાર-નવાર ઉઠે છે કે ગીતામાં કખા મુજબ ભગવાન હવે ક્યારે જન્મ લેશો? આ પ્રશ્નનું રહસ્ય ખૂબ ઉંડાણથી સમજવા જેવું છે.

જ્યારે જન્મ લેવાની જરૂરત પડે છે ત્યારે ભગવાન કોઈ એક વ્યક્તિરૂપે જ જન્મતા નથી પણ તેઓ અનેક સંતો અને સજજનોરૂપે અનેક દેશોમાં જન્મ ધારણ કરે છે અને તેઓ પોતપોતાની રીતે જગતનું કલ્યાણ કરતા હોય છે. હવે. એક બીજું રહસ્ય પણ સમજાયો.

સજજન પુરુષો અને સંતજનોને લોકકલ્યાણ અર્થે જન્મ તો ધારણ કરવો છે પણ તેમને કોઈ જન્મ ધારણ કરવા જ દેતું નથી! કારણ કે હાલના સુધારાવાદ અને ફેશનવાદના ગાંડપણમાં જગતમાં અસંખ્ય ગર્ભપાત થઈ રહ્યા છે તેથી જગકલ્યાણ અર્થે જેમને જન્મવું છે તેમનો સૌનો વિનાશ થઈ જાય છે. તેઓ અનેક વાર ગર્ભમાં આવે છે અને તેમનો અનેક વાર નિર્મમપણો નાશ કરી નાખવામાં આવે છે.

ભૂષણકારીના ગાંડપણમાં રાચનારાઓએ એ યાદ રાખવું જોઈએ કે અસંખ્ય સંતો અને સજજનોનો આપણો ગર્ભમાં જ ધાણ કાઢી નાખીએ છીએ, પછી તેઓ આપણું કલ્યાણ કરવા આવે જ કઈ રીતે? અને જે સંતો, સજજનો અને અવતારો હ્યાત છે, હાજર છે તેમની વાત આપણા ગળે જ ઉત્તરતી નથી! તેમને આપણો ગાંડા, જુનવાણી અને ગામડિયા ગણીને તેમની ઠઠામશકરી ઉડાડીએ છીએ! તેઓ આપણા કલ્યાણના અનેક ઉપાયો જાણો છે છિતાં તેમને મજબૂરીથી ચૂપ થઈને બેસી રહેવું પડે છે; કારણ કે આપણને તેમના તરફ પૂર્વગ્રહ થઈ ગયો છે. તેથી ભગવાન અવતાર કેમ નથી લેતા? તેવો પ્રશ્ન કરવાનો કે તેવી આશા રાખવાનો આપણાને કોઈને હક્ક કે અધિકાર નથી.

આપણો આપણા વચનનું જો પાલન ન કરતા હોઈએ તો ભગવાન શા માટે પોતાના વચનનું પાલન કરે? આ પ્રશ્ન સર્વેએ ખૂબ ગંભીરપણે વિચારવો પડે તેમ છે.

પંચમહાભૂતનાં બનેલાં બધાં શરીરો માતાપિતા દ્વારા જ જન્મવાનાં, પછી ભલે તે શરીરો દેવ, દાનવ જુલાઈ-૨૦૦૮

કે માનવનાં હોય. શરીર, પિતા દ્વારા માતાના ગર્ભશયમાં અને ત્યાર પછી જ જગતમાં જન્મ પામવાનું, આ જ પંચમહાભૂતનાં શરીરોને જન્મ લેવાનો કમ છે, અને જેનો જન્મ તેનું મૃત્યુ, એ કમ પણ સનાતન સત્ય છે. ભલે ગમે તેટલા મોટા અવતારી પુરુષ હોય પણ તોય કોઈ આકાશમાંથી ઉત્તરવાના નથી, કે નથી તો પૃથ્વીમાંથી પ્રગટ થવાના. મોટામાં મોટા અવતારી જનો, કે મોટા સંતો, કે મહાન સજજનો સૌ ગર્ભશયના માધ્યમથી જ જન્મ ધારણ કરી શકે છે. ગર્ભપાતના ગાંડપણના કારણે આમાંના કોઈ જ, શરીર ધારણ કરીને સમાજકલ્યાણ માટે અવતાર ધારણ કરી શકતા નથી. અને તેથી સમસ્ત સમાજ પાપીઓ દ્વારા ધમરોળાતો અને રગદોળાતો રહે છે.

કલ્યાણકારી અનંત પ્રકારની સુખસગવડોની શોધો કરનારાઓ પણ એક પ્રકારના અવતારી પુરુષો જ ગણાય. ગર્ભપાતના કારણે આમાંના પણ કોઈ, અવતાર ધારણ કરી શકતા નથી.

જે ભગવાન હાલમાં હાજર અને હ્યાત છે તેઓ સર્વેને પ્રાર્થના કરીએ કે તેઓ આપણાને સર્વેને સન્મતિ આપે. સન્મતિ માગવા જેટલી તો આપણામાં બુદ્ધિ અને પ્રાર્થના કરવા જેટલી નમ્રતા હોવી જોઈએ.

જ્યારે ગર્ભશયમાં નક્કિનના ભળભળતા અનિમાં આપણું રોમેરોમ બળતું હતું ત્યારે તો ભગવાનને ખૂબ પ્રાર્થનાઓ કરી અને વચનો આખાં હતાં કે હે નારાયણ! હે મહેશ્વર! આ નક્કિનમાંથી છૂટીશ તો આપણું ભજન કરીશ, આપણાં ચરણોમાં બેસીશ અને સાંખ્યનો તથા યોગનો અભ્યાસ કરીશ. પણ જે ઘડીએ જન્મ થયો અને બહારના વાયુનો સ્પર્શ થયો કે તે જ ઘડીએ બધાં જ વચનો ભૂલી ગયા અને જેમજેમ મોટા થતા ગયા તેમતેમ અનંત કાવાદાવામાં, રાગદ્રેષમાં, માનઅપમાનમાં અને અભિમાન-અંહકારમાં રમમાણ થઈ ગયા! આપણું કલ્યાણ કરે એવા આપણો આપેલાં બધાં જ વચનો આપણો ભૂલી ગયા છીએ અને ભગવાને આપેલું એક વચન આપણો યાદ રાખ્યું છે તે કેવું આશ્વર્ય!

ભગવાન તો પોતાના વચનનું પાલન કરી જ રહ્યા છે પણ તે જોવાની પણ આપણી પાસે દસ્તિ હોવી જોઈએ.

નિત્ય દર્શન

સંકલન: ડૉ. સ.સ.મિશ્ર

સત્ય ધર્મ ગુરુદેવકી જ્ય-સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને એમની જ્ય તો જ આપણી જ્ય.

પોતાના ગુરુદેવનાં રોજે રોજ દર્શન થાય, તેમના સાનિધ્યમાં રહેવાય, તો તેનાથી મળતો લાભ અનેરો હોય છે. પ. પૂરુષ ગુરુદેવના સાનિધ્યમાં રહીએ તો આધ્યાત્મિક લાભ તો થાય જ છે. સાથે-સાથે સાચી સમજ કેળવાય છે. રોજે રોજનાં કાર્યો કેવી કુશળતાથી કરવાં, તેમાં નિયમિત્તતા જાળવવી શક્ય હોય ત્યાં સુધી જાતે જ અને ખૂબ રસપૂર્વક કામ કરવાં વગેરેની સમજ કેળવાતી જાય છે.

પૂરુષીએ સાંધેલું ધોતિયું પહેર્યું હોય તો ભક્તજનોને નવું ધોતિયું લાવવાની હચ્છા થાય અને ઘણા ભક્તો નવું ધોતિયું લાવી પણ હે. પૂરુષીએ ખ્યાલ આવી જ જાય એટલે ભક્તોને સમજાવતાં કહે કે અમને દરજ કામ આવડે છે એટલે તેનો ઉપયોગ કરીને જરી ગયેલો ભાગ કાઢી નાખી સાંધો કરીને પહેરોએ છીએ. ધોતિયાં નથી એમ નથી. ધોતિયાં તો ઘણાં બધાં છે. નવાં ધોતિયાં પ્રસાદી તરીકે ભક્તોને આપી શકાય કોઈને જૂનું વસ્ત્ર ન અપાય. વળી આવું બધું જાતે કરવામાં આનંદ પણ ખૂબ આવે.

જ્યારે જ્યારે ભક્તો આવે ત્યારે મિઠાઈનાં પડીકાં લેતા આવે. મિઠાઈ પ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચી બધાં ખાતી બોક્સ તથા રબર-બેન્ડનો ગુરુજી સંગ્રહ કરે. કોઈ ભક્ત વધારે મિઠાઈ કે કોઈપણ જાતનો પ્રસાદ લાવે તો ગુરુજી પેલા સંગ્રહ કરેલા બોક્સમાં બધાને પ્રસાદ આપે. કબાટે ભરાવેલાં રબર-બેન્ડ તે બોક્સ પર લગાવીને આપે કે જેથી તેમાંથી પ્રસાદ વેરાય નહીં. આ બધું પોતાની જાતે જ કરે. પ્રસાદ આપતી વખતે ક્યારે વાપરવો, અને કેટલા સમયમાં વાપરી નાખવો તે સૂચના તો હોય જ. પ્રસાદ ગુરુજી પોતે ટેસ્ટ કરે અને શંકાશીલ લાગે તો ન આપે.

જુલાઈ-૨૦૦૭

પૂરુષીને બધા વિષયોમાં રસ એટલે ઓઝિનિયરિંગ, મેડીકલ, કોમ્પ્યુટર કે મોબાઇલ ગમે તે હોય તેનો ઊંડો અભ્યાસ કરે અને નવી નવી વસ્તુ શોધી કાઢે અને ભક્તો ને સમજાવે. કોઈપણ વિષય ના નિષ્ણાતો ન જાણતા હોય તેવું પૂર્જ્યશ્રી શોધી કાઢે અને તેને સમજાવે. ઘણા લોકો વસ્તુ લાવતા હોય છે. પણ તે વિષેની જાણકારી ન હોય. પૂર્જ્યશ્રી પાસે વસ્તુ આવે એટલે પૂરે પૂરી જાણકારી મેળવ્યા પછી જ તે વસ્તુ વાપરવાની શરૂ કરે.

પૂર્જ્યશ્રી પાસે સુથારી, લુહારી, ઈલેક્ટ્રોસિટિ વગેરે કોઈપણ વિદ્યા-કળાને લગતાં તમામ સાધનો હાજર જ હોય. નાની ખીલી જોઈતી હોય કે મોટાં ડિસમિસ, પક્કડ, પાનાં તમામ હોય. આપણી પાસે કદાચ હોય બધું પણ જ્યારે જરૂર પડે ત્યારે ખોળવામાં જ દિવસ વીતી જાય. પૂરુષી કાંતો પોતે તરત કાઢી આપે અથવા આપણાને દિશા - સૂચન કરે તો ત્યાંથી અવશ્ય મળી જાય. બોલાવેલો કારીગર પૂર્જ્યશ્રીના સૂચન મુજબ કામ કરે તો ઝડપથી અને ચોક્સાઈપૂર્વક કામ પૂરું કરી શકે.

આવું તો કાઈ કેટલુંય વિચારવા જેવું, નિરીક્ષણ કરવા જેવું હોય છે પણ આપણે પૂર્જ્યશ્રી પાસે બેઠા જ કયાં હોઈએ છીએ! ઘરે હોઈએ ત્યારે પૂર્જ્યશ્રીનાં દર્શને જવાનું રટણ ચાલતું હોય અને પૂર્જ્યશ્રી પાસે બેઠા હોઈએ ત્યારે મન આપણું બીજે કયાંય રખડતું - ભટકતું હોય. અને એ પણ ખરું કે આપણી પર ઓમ્પરમાત્માની દ્યા હોય અને પૂર્જ્ય ગુરુદેવશ્રીની કૃપા હોય તો જ આપણાને આવું બધું જોવા મળે, કદાચ જોવા મળે પણ વિચારવાનું રહી જાય, વિચાર કરીને અમલમાં મૂકવાનું તો ભાગ્યશાળીને જ ભાગે જતું હોય છે.

સત્સંગ - સ્વાધ્યાય

પ.પુ.ગુરુદેવશ્રી યોગભિક્ષુજીના સ્વાધ્યાય સત્સંગમાંથી સાભાર

સંકલન: ડૉ. સ.સ.ભિક્ષુ

૩૦ જન્મ-મરણ એક ઘટનાક્રમ ૩૦

સત્ય ધર્મ ગુરુદેવકી જ્ય.

સત્ય અને ધર્મ એજ આપણા ગુરુદેવ અને તેમની જ્ય તો જ આપણી જ્ય.

લાંબા સમયથી ગુરુદેવની સેવામાં રહેલા એવા એક ગુરુભાઈને ત્યાં પૂ.ગુરુજી સાથે જવાનું થયેલું. પ્રસંગ હતો શોકનો, ગુરુભાઈના મોટાભાઈનું અવસાન થયેલું. સ્વર્ગવાસી પણ પૂજ્યશ્રીના ભક્ત હતા.

શોકસભામાં પોતાનું સ્થાન ચેહણ કરતાં પહેલાં સર્વ ગુરુભાઈ-બહેને પૂજ્યશ્રીને વંદન કરી આશીર્વાદ લીધા. પૂજ્યશ્રીએ કહ્યું કે

જન્મ અને મૃત્યુ એ જીવનના જુદા જુદા ઘટનાક્રમોમાં પહેલો અને છેલ્લો ઘટનાક્રમ છે. બંને પ્રસંગો આપણાને ચેતવે છે કે આ કમમાંથી ધૂટવું હોય તો- મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો- ઈશ્વરને શરણો જવું જોઈએ- ઈશ્વર સ્વરૂપ કોઈ સદગુરુના શરણમાં જવું જોઈએ.

યોગ-પ્રાણાયમ, કસરત, સાધના કે કોઈપણ આરોગ્યના નિયમ પાળો, યોગશાસ્ત્રના કે વિવિધ જીતના આરોગ્યને લગતા નિયમ પાળીએ તોય, મૃત્યુ તો નિશ્ચિયત જ છે. આરોગ્યના નિયમો તો શરીરને નિરોગી-સ્કુર્ટિવાળું રાખવાની યુક્તિ-પ્રયુક્તિ છે. તેનાથી અમરપણું મળવાનું નથી. જગતમાં જેટલી પણ પથીઓ- નેચરોપથી, એલોપથી, આયુર્વેદ કે બીજી ઘણી

બધી, તેનું સેવન કરવાથી શરીરને અમરપણું મળવાનું નથી. મૃત્યુ તો નક્કી જ છે પણ તેથી શરીરનું આરોગ્ય જળવાય છે અને તેથી ઈશ્વર - સ્મરણ થઈ શકે છે.

આરોગ્યના નિયમો પાળવાથી આપણાને અમરપણું મળતું નથી એટલે આપણો આરોગ્યના નિયમો ન પાળવા એમ નહીં, તેનું આચરણ ન કરવું એમ નહીં બરાબર જ પાળવા જોઈએ, કે જેથી જેટલું પણ જિવાય તેટલું તંદુરસ્ત જિવાય - સુખી જિવાય અને ઈશ્વર - સ્મરણ સારી રીતે થાય - મનુષ્ય જન્મ સફળ થાય.

આપણાથી મોટા (મુરબ્બી) જે આપણું તથા કુટુંબનું છત્ર હતા, જેમના દ્વારા કુટુંબ સારી રીતે ચાલતું હતું, તે જાય ત્યારે આપણાને આપણું છત્ર ગુમાવ્યાનું દુઃખ થાય છે. પણ આને જીવનનો ઘટનાક્રમ સમજ દુઃખમાંથી બહાર નીકળી જવાનું છે કારણ-આપણો આપણાથી નાના તથા આપણા આધારિતનું છત્ર બનવાનું છે. હવે આપણો છત્ર બનીને રહેવાનું છે. બીજાઓનું આપણો છત્ર બનીને તેઓ સુખી થાય તેવા પ્રયત્નો કરવાના છે. તેઓ સર્વેની સાથે રહી મનુષ્ય જન્મ સફળ થાય તેવા પ્રયત્નો કરવાના છે. આપણો પણ આ ઘટનાક્રમની બહાર નથી આપણો પણ એક દિવસ મૃત્યુને સ્વીકારવાનું છે. જીવનનો છેલ્લો કુમ સ્વીકારવાનો છે.

૩૧ સમય વર્તે સાવધાન ૩૧

સત્ય ધર્મ ગુરુદેવકી જ્ય- સત્ય અને ધર્મ એજ આપણા ગુરુદેવ. અને એમની જ્ય તો જ આપણી જ્ય.

પ. પુ. ગુરુદેવ પાસે અવાર-નવાર જવાનું થાય ત્યારે જીવનમાં સુખી થવાની સામગ્રી મળી જ રહેતી હોય છે. પૂ.શ્રી ના એકે-એક શર્દું આપણા જીવન માટે ખૂબ ઉપયોગી હોય છે.

જુલાઈ-૨૦૦૭

એક વખત પૂ.શ્રી ની સન્મુખ બેઠા હતા ત્યારે કસરતની વાત નીકળી તેમાંથી પૂ.શ્રી એ કહ્યું,

નાનો કુમળો છોડ મોટો થતો હોય ત્યારે જેમ વાળીએ તેમ વળો. સારાં ખાતર - પાણી આપીને તેને ઉછેરીએ. મોટો થાય એ છોડની જ્યાં સુધી કોમળતા હોય ત્યાં સુધી આપણો જેટલા વળાંક આપવા હોય

તેટલાં આપી શકીએ. આપણી મરજી પ્રમાણો તેને વાળી શકીએ, મૂકી શકીએ.

ઇડ પાકટ થાય, પછી તે ગમે તે છોડ હોય, મોટું વૃક્ષ હોય કે નાનો છોડ હોય, તેને વાળવા કે મરડવા જઈએ તો તે તૂટી જાય કાં તો સુકાઈ જાય. અથવા આપણો આપેલો વળાંક આપણી ઇચ્છા પ્રમાણેનો ના હોય. તેને વધવાની દિશા બદલાઈ જાય કે તેનું વધવાનું અટકી પડા જાય. આમ જોઈએ તો આ વાત સામાન્ય લાગે પડા આપણને સમજાવવા માટે, સાચી સમજ કેળવવા માટે ઘણું બધું મળી ગયું

આપણો કસરત કરતા હોઈએ ત્યારે-નાની ઉમરમાં શરીરને જેમ વાળવું હોય તેમ વળો. શક્ય તેટલાં અંગોને આપણો આપણી મરજી મુજબ વાળી શકીએ તેને ભરોડ આપી શકીએ. અમુક ઉમર પછી તેવા ભરોડ આપવા જતાં-નસ વળગો, ચસક આવી જાય કે કોઈક વખત ફેફર પડા થાય. વળી ઊચા પ્રેસર વાળાને ઘણી બધી તકલીફો થઈ શકે.

મોટી ઉંમરે ઉંમરના પ્રમાણમાં કસરત કે ખાવા - પીવામાં, પહેરવા-ઓડવામાં સંયમથી વર્તવું જોઈએ.

સાંસારિક બાબત લઈએ તો પોતાનાં બાળકો

નાનાં હોય ત્યારે આપણો આપણી મરજી પ્રમાણો કામ લઈ શકીએ. જેમ જેમ મોટાં થતાં જાય તેમ તેમ તેમની રુચિ પ્રમાણો વળાંક આપવાથી તે છોડ સારો તૈયાર થાય છે. પણ એક વખત પાકટ છોડ થયા પછી એટલે કે પોતાનાં બાળકોની અમુક ઉમર થયા પછી એજ રીતે વાળવાની કોશિશ કરીએ તો તે છોડ તૂટી જાય-આપણાથી દૂર ભાગી જાય. આપણો જેવી રીતે વાળવાં હોય તેની ઊંધી દિશામાં વળો, કે આપણું સ્વમાનભંગ થાય, આપણું અપમાન થાય તેવું વર્તન કરે. એટલે પોતાનાં બાળકોમાં પરિપક્વતા આવ્યા પછી જરૂર વગરનું તેમનામાં માથું મારવું ના જોઈએ. સુખી થવું હોય, તેઓની સાથે રહેવું હોય તો સાથ- સહકારની ભાવનાથી રહેવું જોઈએ.

પૂ.શ્રી વાત - વાતમાં આપણને આરોગ્ય તેમજ સાચી સમજણની વાતો સમજાવી દે છે અને આપણું સાંગું આરોગ્ય જળવાય તેમજ સંસારિક રીતે એટલે કે આપણો ગૃહસ્થાશ્રમ સરખો ચાલે તેવા પ્રયત્નો કરતા હોય છે. મૂળ વાત એક જ કે આપણું મગજ એટલે તન-મન પૂ.શ્રીના ચરણોમાં લાગેલું હોવું જોઈએ.

સફળતા

- ભિનિષ બી. પટેલ

‘સફળતા’ કોને કહી શકાય? સફળ વ્યક્તિ કોણા બની શકે, હોઈ શકે? દરેક વ્યક્તિ સફળતાનું અર્થધટન પોતાની રીતે કરતી હોય છે. પૈસાદાર બનવું, સમજામાં બહુ મોટું નામ બનાવવું વગરે જેવી ઘણી સફળતાઓ દરેક વ્યક્તિના મનમાં ફરતી હોય છે. અને આ પ્રકારની સફળતા મેળવવા માટે થઈને વ્યક્તિ તન-તોડ પ્રયત્નો કરતી જ રહે છે.

આ બધી સફળતાઓ મેળવવા માટે વ્યક્તિ પાસે એક નિસરળી હોય છે, જે નાનપણથી જ ઉપયોગમાં લેવાતી હોય છે. અત્યાસ દરમ્યાન નંબર આગળની હરોળમાં રાખવાની મહેનત, ત્યારબાદ વ્યવસાયમાં કે નોકરીમાં સહયોગીઓથી આગળ નીકળી વધુ પૈસા-નામ કમાવાની હરીઝાઈ. અને પાછું આ બધાં ક્રમ કરાવવા માટે આપણો ભગવાનને પણ સાથે લઈ લઈએ છીએ. ‘હે ભગવાન જો મારો પહેલો નંબર આવ્યો તો હું તમને શ્રીફળ ચઢાવીશ’, ‘હે માતાજી મારો પગાર વધશે તો હું તમને ચુંદરી ચઢાવીશ’, કે જુલાઈ-૨૦૦૭

પછી ‘મારો ધંધો બહુ સારો ચાલશે તો મંદિરે દર્શન કરવા ચાલતો આવીશ’, આવાં વાક્યોથી આપણો ભગવાન પાસે સફળતા માંગતાં હોઈએ છીએ.

શું ખરેખર આપણો ભગવાન પાસે સાચી સફળતા માંગતા હોઈએ છીએ? આવી બધી માંગણીઓ તો દરિયામાંથી એક લોટો પાણી ભરવા જેટલી નાની હોય છે. દરિયો તો જેટલું પાણી જોઈએ તેટલું આપવા તૈયાર હોય છે, આપણો તેમાંથી એક લોટો પાણી ભરીને સંતોષ માની લઈએ છીએ.

તો પછી, માણસનું જીવન સફળ થયું તેવું ક્યારે કહી શકાય? જ્યારે આપણો આપણું જીવન શાંતિપૂર્વક અને સુખમય જીવી જાણીએ તેને જ ખરી સફળતા કહેવાય. ભગવાન પાસે માંગવું જ હોય તો જીવનની આવી સાચી સફળતા માંગીએ. આપણો તો દરિયાને એટલી જ પ્રાર્થના કરવાની હોય કે મને ઉપયોગી થાય એટલું પાણી આપો, એટલે આપણને જેટલું જરૂરી હોય તેટલું પાણી આપણને મળી જાય.

ખૂબ પૈસાદાર બનવાની લાલચમાં આપણે ઘણાં નાં દિલ દુઃખાવતા હોઈએ છીએ. માન-સન્માન મેળવવાની લાલચમાં બીજાઓનું અપમાન કરતાં વાર નથી કરતા. આવી બધી વાતોથી એવું નથી સમજવાનું કે આપણે કંઈ કરવું જ ના જોઈએ. આપણે તો જીવન-નિર્વહ ચલાવવા કે પરિવારની જવાબદારીઓ પૂરી કરવા માટે કમાવવાનું તો છે જ પણ કેવળ પૈસા બનાવવાનું ધ્યેય ન રાખતાં, સારી રીતે જીવન જીવીને, બીજાને પણ સાથે લઈને આગળ વધવાનું છે.

થોડા સમય પહેલાં સાંભળ્યું હતું કે દુનિયાની

સૌથી ધનાઢ્ય વ્યક્તિએ પોતાની બધી મિલકત દાન કરીને લોકસેવામાં જીવન વ્યતીત કરવા માંડ્યું. આ બનાવ આપણાને શું સમજાવે છે? ખૂબ ધન અને માન કમાયા પછી પણ છેવટે તો મનને શાંતિ મળે તેવા જ જીવનની લોકો આશા રાખે છે. તો પછી શું આપણે મનને શાંતિ મળે તે રીતે ધન અને માન ના કમાઈ શકીએ? જરૂર કમાઈ શકીએ. મનુષ્ય જીવન મળ્યું છે તો તેને સાથે કરી જાણીએ.

અસ્તુ.

વ્યસન

- મિનિષ બી. પટેલ

‘વ્યસન’ શબ્દ સાંભળીને આપણી નજર સમક્ષ સીગરેટ પીતો માણસ, તમાકુ ખાતો માણસ કે દારુ પીતો માણસ આવી જાય. નિર્વસની માણસ આ શબ્દ સાંભળીને વ્યસની ઉપર ધૂતકાર વરસાવે. તેને એક અલગ દ્વિષ્ટી જુએ, અને તેને બે-ચાર જરૂરી શિખામણ આપે. આવાં વ્યસનો તો ચોક્કસ જ ખરાબ છે, પણ જે વ્યસન નિર્વસની માણસો કરે છે, તેવા વ્યસનની આજે આપણે વાત કરીશું.

‘નિર્વસની માણસનું વ્યસન’, સાંભળીને આશ્ર્યથી થશે. પરંતુ તે સત્ય છે. સમાજના કહેવાતા નિર્વસની વ્યક્તિઓનું જે અતિ નુકશાનકારક વ્યસન છે તેને આપણે એક-બે ઉદાહરણ દ્વારા સમજ્યાએ.

એક પરિણીતા સ્ત્રી- જે સમાજનાં કહેવાતાં આ બધાં વ્યસનોની સખત વિરોધી છે. સૌ પ્રથમ તેમના વ્યસનની વાત કરીએ. એ બહેનને રોજની એક આદત. તેમને દિવસમાં એક વાર પણ તેમના પિયરમાં તેઓની મમ્મી સાથે ફોન પર વાત ના થાય ત્યાં સુધી ચેન ના પડે. સંયુક્ત કુટુંબમાં રહેતાં હોવાથી તેમને ઘરેથી ફોન કરવાનો મોકો ના મળે તો તેમના પતિની ઓફિસથી પણ દિવસમાં એકવાર તેમની મમ્મી સાથે વાત કરવી જ પડે. વાતો જો કંઈ કામની હોય કે પરિવાર કે સમાજના ઉત્કર્ષ માટેની હોય તો વ્યાજબી છે. પરંતુ ફ્લાઇટી બહેને આમ કર્યું, મારાં સાસુએ આવું ક્રીધું, ફ્લાઇટી વ્યક્તિને ત્યાં આવું બન્યું, આવી બધી વાતો ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ ચાલે, તેમના પતિ પોતે તમાકુ ખાવાના વ્યસની છે. જો તેમણે બહેનની સામે તમાકુ ખાધી હોય તો બહેન તેમને શિખામણ આપે. જ્યારે પતિની ઓફિસમાંથી રોજ આ જુલાઈ-૨૦૦૮

પ્રકારેનું તેઓનું ફોન કરવાના વલશની સામે, ડેરાન થવા છતાં તે ભાઈ કશ્યું જ ના બોલે.

હવે જો તે ભાઈનું વ્યસન તમાકુ ગણીએ તો તેમના પત્નીનું વ્યસન ફોન ના ગણી શકાય? જેવી રીતે તમાકુ, બીડી-સીગરેટ વગર માણસ તરફડતો હોય છે તેવી જ રીતે તે બહેન દિવસમાં ઓછામાં ઓછી વીસથી-પચીસ મિનિટ તેમનાં મમ્મી સાથે વાત ના કરે તો તરફડતાં હોય છે. તમાકુ જેવાં વ્યસનતો જે માણસ કરે તેમને જ નુકશાન કરતાં હોય છે. પરંતુ આ બહેનને છે તેવું વ્યસન તો કુટુંબ, સમાજ કે દેશનું નુકશાન કરતાં હોય છે. જો તે બહેન ધારે તો તેમનાં સાસુ સાથે પણ ઘણી વાતો કરી શકે છે. પણ આપણા સમાજમાં એક ભૂસું ભરાઈ ગયું છે અને તેને કારણે આપણે સાસુ ને મમ્મી નો દરજાઓ આપતા જ નથી. બે સંબંધોની વચ્ચે એક અંતર રાખવાથી તે અંતર વધતું જ જાય છે.

આ ઉદાહરણથી એવું નથી માનવાનું કે તે બહેને તેમનાં મમ્મી સાથે વાત ના કરવી જોઈએ. તેમણે વાતો તો જરૂરથી કરવી જોઈએ પણ તે સમયાંતરે કરવી જોઈએ. અને આ વાતો કુટુંબનું કલ્યાણ થાય, પરિવારો વચ્ચે સેતુ બંધાય તેવા પ્રયત્નોની કરવી જોઈએ.

બીજું ઉદાહરણ એક ભાઈનું છે. એમનું વ્યસન છે ટેલીવિઝન. વ્યવસાયનું ક્રમ પતાવ્યા પછી ધરે આવીને ટી.વી. ચાલુ કરીને બેસી જાય. તેમને સામાજિક સીરીયલો જોવાનો બહુ શોખ. ટી.વી. ની ચેનલો ઉપર અત્યારે તો ઘણી બધી સામાજિક સીરીયલો આવતી હોય છે અને ઘણા લોકો આ

સીરીયલોને રસપૂર્વક જોતા પણ હોય છે. પરંતુ હું; ખની વાત એ છે કે આ સીરીયલોમાં જે કુટુંબો બતાવાતાં હોય છે તેમાં અંદરો-અંદર ભારો ભાર રાજક્રણ રમાતું હોય છે. આ ભાઈને આવી સીરીયલોમાં બહુ જ રસ પડે. તેમનું બાળક તેમની સાથે કાલીઘેલી વાતો કરવા જાય કે સ્ક્રૂલમાં તેણે શું કર્યું તે કહેવા જાય, તો તેને ખખડાવી નાખે. ગુસ્સાથી તેને ધમકાવે અને કહે કે સીરીયલ પતી જાય પછી જે કહેવું હોય તે કહેજે. બાળક દ્યામણું મોં કરીને એક બાજુ બેસી જાય.

શું આ ભાઈનું વસન મહાભંયકર ના ગણી શકાય? કે જે તેમનું તો નુકશાન કરે જ છે, સાથે-સાથે ઘરના દરેક સભ્યને પણ હાનિ પહોંચાડે છે. આ તો એક ભાઈનું ઉદાહરણ છે પરંતુ આવાં તો ઘણાં ભાઈ-બહેનો હશે કે જેમને આવું વસન હશે. શું આવાં વસનોને બંધ ના કરી શકાય.

મનુષ્ય સમાજને નુકશાન કરતાં આવાં તો ઘણાં વસનો હશે. જે આપણી જાણ બહાર હશે. આવાં વસનોને શોધીને જડ-મૂળથી ઉભેડી નાંખવા જોઈએ. પોતાનામાં રહેલું આવા પ્રકારનું છૂપું વસન દરેક વ્યક્તિ પોતેજ ઓળખી શકે છે. તેને ઓળખીને દરેકે નિર્વસની બનવું જોઈએ.

પચે એ કરતાં વધુ ખાવું તે દારુ અને તમાકુ મસાલા કરતાં પણ વધુ નુકશાનકારક છે. પણ મનુષ્ય સ્વાદવશ પેટ પર અત્યાચાર વર્ષો સુધી કરતો જ રહે છે અને પછી કેન્સર જેવા અસાધ્ય રોગમાં સપડાય છે. સ્વાદરૂપી દુશ્મન, જીભરૂપી ચોકીદારને ફોડીને ઉદરમાં પ્રવેશી જાય છે અને મનુષ્યના આરોગ્યને છિન્નભિન્ન કરી નાખે છે. સાચી ભૂખ હોય ત્યારે સાદો સાન્નિવક આહાર પણ ખૂબ જ મીઠો લાગે છે. સ્વાધને વશ થઈને મનુષ્ય વગર ભૂખે પણ ખૂબ ખાઈ નાખે છે. તેથી જ અનુભવીઓ અસ્વાદ ને પણ વ્રત ગણે છે. મોળાકત એ સાચો શબ્દ મોળાવ્રત છે. મોળાકત અને અન્ય વ્રતો નિમિત્તે બાળપણથી જ સ્વાદજીત થવાની તાલીમ મળે છે. પચે એથી વધુ ખાવું એ પણ એક ભયંકર દુર્વસન છે. તેથી જ પૂ. ગુરુજીએ આપણને આ સરસ સૂત્ર આપ્યું છે; “જીભપર જેનો કબૂ, જગપર તેનો જાદુ; જેનું જીવન સાંદુ, આરોગ્ય તેનું જાંદુ.” માણસે અન્યોના દોષ ન જોતાં, પોતે જે પગથીએ હોય તેનાથી ઉપરના પગથીએ ચડવાનો પ્રયત્ન કરવો જોઈએ, એજ ખરી બુદ્ધિમાની છે.

-અસ્તુ.

પુનિત પ્રેરક સંસ્મરણો

- શાશીક્રાન્ત પટેલ

સત્ય-ધર્મ ગુરુદેવની જય.

સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને એમની જય તો જ આપણી જય.

સંસ્મરણ એટલે સંભારણું. આપણા જીવનમાં ઘટતા એવા કયા પ્રસંગને સંભારણું કહેવું તેની સમજ ખૂબ જ અગત્યની છે. દરેક મનુષ્યના જીવનમાં અનેક નાની- મોટી, સારી-ખોટી સાંસારિક ઘટનાઓ સામાન્ય રીતે સતત ઘટતી જ હોય છે. જેમ માળામાં પણ એક પછી એક માણકો આવે તેમ જીવનમાં પણ એક પછી એક ઘટના ઘટતી હોય છે તેનું જ નામ જીવન. આવી સામાન્ય ઘટનાઓને પણ આપણે આપણી ઓછી સમજને કારણે સંભારણામાં ખપાવી દઈએ છીએ. વાસ્તવમાં મનુષ્યના જીવનમાં કોઈ એવી અતિહુર્લભ, કૃત્યનાતીત ઘટના ઘટે છે કે જે તે મનુષ્યનું આખું

જીવન બદલી નાંખે છે, જીવન જીવવા પાછળનો ઉદ્દેશ્ય બદલી નાંખે છે તેવી ઘટના તે મનુષ્ય માટે અવિસ્મરણીય કહેતાં ભૂલી ન શકાય તેવું સંભારણું બની જાય છે.

અમારા એટલે કે મારા અને મારાં ધર્મ-પત્ની ઉષાબેનના જીવનની વાત કરીએ તો જે ક્ષણે પ. પૂ. સદગુરુદેવ શ્રી યોગભિક્ષુજી મહારાજનો મેળાપ થયો તે શુભ ક્ષણ પછીનું અમારું સમગ્ર જીવન એ એક અવિસ્મરણીય સંભારણું બની રહ્યું છે. ગુરુદેવના મેળાપ પહેલાં પણ જીવન તો જીવતાં જ હતાં પરંતુ એ જીવન માત્ર અમે ભૌતિકતાની પ્રાપ્તિ માટેનું સાંસારિક સામાન્ય દુન્યવી જીવન જ જીવી રહ્યાં હતાં. પરમાત્માએ અહેતુકી કૃપા કરી મનુષ્ય જીવન આપ્યું છે તો તે જીવનને વધુમાં વધુ ઉજ્જવળ કંઈ રીતે કરવું

તેની સમજ ન હતી. આ બાબતમાં બિલ્કુલ અજ્ઞાન હતાં. જ્યારથી ગુરુદેવનો મેળાપ થયો ત્યારથી આજ દિન સુધી મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે તો જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય શો હોવો જોઈએ? જીવનની સાર્થકતા શેમાં રહેલી છે? બાળકોમાં સંસ્કારનું સીચન કેવું કરવું જોઈએ? ઘર, કુટુંબ, સગાં, સ્નેહી, સમાજ પ્રત્યે આપણું વર્તન કેવું હોવું જોઈએ?. ઘરેલું સામાન્ય જીવન તથા આપણી રહેણી- કરણી, ખાન-પાન કેવાં હોવાં જોઈએ કે જેથી આપણું તન-મન તંદુરસ્ત રહે? સુખ અને દુઃખમાં કેવા સંયમપૂર્વક અને સજાગ રહેવું જોઈએ? સાચું સુખ શેમાં રહેલું છે? જીવ-જગત સાથે નિઃસ્વાર્થ આત્મીયભાવ કેળવવા માટે સભાનપણે વધુમાં વધુ પ્રયત્નશીલ રહેવું, આવી અને ગૃહસ્થ જીવનમાં ઉદ્ભબતી બીજી અનેક જીણામાં જીણી બાબતો પ્રત્યે સાચી સમજણાનું તથા કુદરતના નિયમોનાં અનેક રહસ્યોનું જ્ઞાન કે જે જીવનમાં આત્મિક, આધ્યાત્મિક ઉત્સત્રાયક જ સદ્ગ સર્વદા છે, આવા જ્ઞાનનું અવિરત સિંચન ગુરુદેવ અહેતુકી કૃપાની હેલી વરસાવતા વિચાર, વાણી, વર્તનથી કરી રહ્યા છે. તે સર્વે ક્ષણ તથા પ્રસંગ અમારા જીવનનાં અવિસ્મરણીય સંભારણાં છે. અહીં આવા જ એક પ્રસંગને વર્ણવવાનો પ્રયત્નો કરવામાં આવ્યો છે. ઘણાં વર્ષો પહેલાનો પ્રસંગ છે. તે સમયમાં દરરોજ સાંજે પૂજયશ્રી તેમના નિવાસસ્થાન “ધર્મમેઘ” ના ક્રમાઉંડમાં બેસતા. ભક્તો પણ તે સમયે આવીને અનુકૂળતા પ્રમાણે પૂજયશ્રીના સાનિધ્યમાં બેસતા. અવાર-નવાર પૂજયશ્રી ઉપરિથત ભક્તોને સાચી સમજણાના જ્ઞાનની વાતો સમજાવતા. કોઈ કોઈ વાર આધ્યાત્મિક રહસ્યોને ખુલ્લાં કરતા. મારે નિત્યનો નિયમ હતો કે શક્ય હોય ત્યાં સુધી દરરોજ સાંજે પૂજયશ્રીના સાનિધ્યમાં જઈને બેસવું. દરરોજની જેમ એક દિવસ સાંજે “ધર્મમેઘ” માં પૂજયશ્રીના સાનિધ્યમાં જઈને બેઠો હતો તે સમયે પૂજયશ્રી અને હું એમ બે જ બેઠા હતા. થોડીક વારમાં ત્યાં એક ભક્ત આવીને બેઠા. તેઓ કોઈ કોઈ વાર પૂજયશ્રીના સાનિધ્યમાં આવીને બેસતા. તેઓ સાથે પેંડાનું બોક્સ લઈને આવેલા તે પૂજયશ્રીના ચરણ પાસે મૂક્યું. પૂજયશ્રીએ તેમને પૂછ્યું

જુલાઈ-૨૦૦૭

કે “કેમ ભાઈ, આજે આ બાજુ આવી ગયા? આ પેડાનું બોક્સ કેમ લાવ્યા છો?”

પેલા ભાઈ કહે કે “ગુરુજી આપની કૃપાથી માંથું ફ્લાણું ક્રમ પાર પડી ગયું. આપે જ માંથું ક્રમ પાર પાડ્યું.” પૂજયશ્રી આ સાંભળી હસ્યા અને કહે કે ભાઈ તમાંથું ક્રમ પાર પડ્યું અને તમારી મુશ્કેલી દૂર થઈ તે જાણીને અમને ખૂબ જ આનંદ થયો. પરમગુરુદેવ ઓમ્ પરમાત્માએ તમાંથું ક્રમ પાર પાડ્યું. બાકી એ બાબતમાં અમે કંઈ જાણતા નથી. તમે અહીં આવીને અત્યારે કહો છો ત્યારે અમને તો ખબર પડે છે કે તમારી શ્રદ્ધા ફળી. થોડી વાર પછી તે ભાઈ ગયા. પછી પૂજયશ્રી મને કહે કે પરમાત્માની કેવી અજબ કૃપા આપણા સૌ ઉપર છે. ભક્તોનાં અશક્ય ક્રમ તેમની કૃપાથી શક્ય થઈ જાય છે. ભક્તો આવી ને કહે છે કે ગુરુજી તમારી કૃપાથી માંથું આવું અશક્ય ક્રમ થઈ ગયું ત્યારે અમને ખબર પડે છે કે તેઓનું આવું અશક્ય ક્રમ શક્ય થઈ ગયું. બાકી અમે તે બાબતમાં કંઈ જાણતા નથી હોતા. પછી આવું કઈ રીતે થતું હોય છે તેનું રહસ્ય ગુરુજીએ સમજાવ્યું તેનો સાર નીચે મુજબ છે;

જેમ આપણે સર્વે ભક્તો ગુરુદેવનાં બાળકો છીએ તેમ ગુરુદેવ પોતે પરમ ગુરુદેવ ઓમ્-પરમાત્માના બાળક છે. હવે જો આપણું પોતાનું બાળક કે જે સંપૂર્ણપણે આપણું આશ્રિત હોય તેને કંઈ તકલીફ થાય કે તેનું મન દુભાય તેવું કંઈ બને તો આપણે ગમે તે હિસાબે તેની તકલીફને શક્ય હોય ત્યાં સુધી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સદગુરુદેવના ભક્તો એ એમનાં બાળકો જ છે. આમ પોતાનાં બાળકો પ્રત્યે સદગુરુદેવના હદ્યમાં પ્રેમ, વાત્સલ્ય, કરુણા હોય તે સ્વાભાવિક છે. આપણા જીવનમાં જ્યારે કોઈ તકલીફ, મુશ્કેલી ઊભી થઈ હોય, આપણે હુંઝી હોઈએ તો ગુરુદેવના હદ્યમાં આપણા માટે કરુણા ઊપજે. તેઓશ્રીનું હદ્ય દ્રવી ઊઠે એ સ્વાભાવિક છે. પરંતુ ગુરુદેવ તો પરમ ગુરુદેવ ઓમ્ પરમાત્માને સંપૂર્ણ સમર્પિત છે. યોગશક્તિથી અલિપ્ત રહી કુદરતના-પ્રકૃતિના તમામ નિયમોને આધીન રહી જીવન જવી

રહ્યા છે. હવે જ્યારે આપણા જીવનમાં કોઈ તકલીફિઝિયાલી ઉદ્ભબે છે ત્યારે ગુરુદેવનું હદ્ય દ્રવી ઊઠે છે અને તેઓ પરમ ગુરુદેવ ઓમ્પરમાત્માને મનોમન આપણી મુશ્કેલીને દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. હવે એવું બને છે કે જ્યારે ચારેબાજુ જગતમાં લોકો વિવેકંધ બની ભौતિક-ભોગો પ્રાપ્ત કરવા અને ભોગવવા માટે બેઝામ બની તેની પાછળ દોડી રહ્યા હતા ત્યારે ગુરુદેવ પોતાની ફાટફાટ થતી ભર યુવાનીમાં પોતાના કૌશલ્ય વડે આ ભોગો પ્રાપ્ત કરવા અને ભોગવવા સમર્થ હોવા છતાં પણ તે સર્વેનો ત્યાગ કરીને પરમ ગુરુદેવ ઓમ્પ પરમાત્માને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી તેમનામાં લવલીન થઈ ગયા અને પરમાત્માની પ્રેરણા મુજબ વિચાર, વાણી, વર્તનથી જીવ-જગતના કલ્યાણ માટે થઈને જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. પોતાના આવા વિરલ સપૂત્ર એવા ગુરુદેવની પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચે છે.

પોતાને સંપૂર્ણ સમર્પિત એવા ગુરુદેવની પ્રાર્થના સાંભળી પરમાત્મા પોતે ગુરુદેવના ભક્તોનાં દુઃખ દૂર કરે છે. ગુરુદેવને તો આની કંઈ ખબર જ નથી હોતી. પરંતુ ભક્ત જ્યારે આવીને જણાવે છે ત્યારે ગુરુદેવને તેની જાણ થાય છે. પરમ ગુરુદેવ ઓમ્પરમાત્મા, સદ્ગુરુદેવ તથા સદ્ગુરુદેવના ભક્તો વચ્ચે અદૂટ પ્રેમ, સમર્પણ, શ્રદ્ધા, ભક્તિ, કરુણાનું એવું વર્તુળ રચાયેલું હોય છે કે જે સામાન્ય રીતે કોઈની સમજમાં આવતું નથી. તેથી તેઓ એમ સમજે છે કે ગુરુદેવે ચમત્કાર કર્યો. આપણું દુઃખ, મુશ્કેલી દૂર થઈ. પરંતુ હકીકતમાં ચમત્કાર જેવું કંઈ જ હોતું નથી. ગુરુદેવના સ્વમુખેથી કહેલ આ રહસ્યને સાંભળી મારું હદ્ય ગદ્ગગદ થઈ ગયું.

થોડી વાર બેસી પછી પૂજયશ્રીને પ્રણામ કરી આનંદિત હદ્યે હું ઘરે જવા નીકળ્યો.

જ્યનારાયણ - જ્ય ઓમ્પગુરુદેવ.

પત્રાંશા

સત્ય-ધર્મ ગુરુદેવની જ્ય

હ્લાલા ગુરુદેવ,

ગુરુદ્ધાદ વિશે લખવાનું આવે તો એવો વિચાર આવે કે શું લખીએ? એમના વિશે લખવું એ તો ગજા બહારની વાત કહેવાય. એમનો તો જેણો અનુભવ કર્યો હોય તેમને જ ખબર હોય. મારા દરેક કાર્યમાં ગુરુજીના આર્થીવાદ હોય છે જ. મારા દ્રારના સમયથી અમે ગુરુજીના સંપર્કમાં છીએ. મારાં માતા-પિતા પણ દરેક શુભક્રિયની શરૂઆત ગુરુદ્ધાદના આર્થીવાદથી જ કરાવે છે. મારા જીવનમાં ગુરુજીને લાવનાર મારા માભાપનો ઉપકાર ક્યારેય ભૂલી નહીં શક્ય. જ્યારે પણ મનમાં કંઈક મુંજવણ થાય ત્યારે દાદાના નામનું સ્મરણ કરતાં જ મન જાણો એકદમ હળવું થઈ જતું હોય તેમ અને રસ્તો એકદમ સરળ બની જતો હોય તેમ લાગે છે. ઘણીવાર કંઈક કારણસર ગુરુદ્ધાદ પાસે જઈ શકતું નથી. પરંતુ મનમાં ખાલી તેમના નામનું સ્મરણ કરતાં દાદા જાણો જોડે જ છે એવો અનુભવ થાય છે. દાદા કયાંકથી આપણું ધ્યાન રાખી રહ્યા હોય તેવું લાગે છે.

ગુરુદ્ધાદ આપણાને જ કંઈપણ સૂક્ષ્મ સમજણાનો જ્યાલ આપે છે તે ખરેખર જીવનમાં ઉતારવા જેવી જુલાઈ-૨૦૦૭

હોય છે. તેમાંની ઘણી વસ્તુઓ એવી હોય છે કે તેનો અમલ કરીએ તો જીવનમાં કંઈક ઉચ્ચ કક્ષાએ પહોંચી શકીએ. દાદા તો એમની રીતે સારી સારી ટેવો અને સૂક્ષ્મ રીતે સારી સમજણો આપણાને આપવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ આપણે હજી પણ ગોથાં જ ખાતા રહીએ છીએ.

ગુરુદ્ધાદના આર્થીવાદ અને પ્રેમ હમેશાં આપણા પર વરસતા રહે અને આપણે પણ એમણે આપેલ જ્ઞાનનો બંડાર જો વહેલી તકે મેળવી લઈએ તો ચોક્કસ આપણે જીવનમાં કંઈક મેળવ્યાનો લ્હાવો મળી રહેશે. ગુરુદ્ધાદ હમેશાં આપણી સાથે રહે, અને સદ્ગય હસ્તા રહે, એમની તબિયત સારી રહે અને સદ્ગય જ્ઞાન વરસાવતા રહે એવી પ્રાર્થના.

એજ લી. આપની (દીકરી)
સ્નેહ આર. સેવકના પ્રણામ.

વેરથી વેર.....

પાસે લેણું નીકળતું હશે ત્યાં સુધી જ તે આપણી ઉદારતા અને ક્ષમાનો પ્રતિભાવ નહીં આપે. તેનું લેણું પૂરું થતાં જ યોગ્ય-અનુકૂળ પ્રત્યુત્તર મળવાનો. હિસાથી

હિંસા જ કાટી નીકળતી હોય તો અહિંસાથી અહિંસા કેમ ન સધાય? કેમ ન પમાય? આવી વાતો કરનારા અમારા જેવા ઘણાબધા અને આવી વાતો સાંભળનારા અને વાંચનારા આપના જેવા ઘણાબધા ભલે આનું પાલન-આચરણ ન કરી શકે તેથી કંઈ વાસ્તવિકતા, અવાસ્તવિકતા નથી થઈ જતી. વહેલા કે મોડા ‘અપ્રિય સત્ય’ કોઈક તો કહેલું જ પડશે. તેથી જેટલું વહેલું કહેવાય તેટલું વહેલું શ્રેય.

સૌના જવન માટે અતિ અનિવાર્ય એવી જેતી પાછળ પણ નાછૂટકાની જે જીવિંસા થતી તેમાંથી મુક્ત થવા માટે ઉત્પાદનના અમુક ટક દાન, ધર્મ, પુષ્યમાં વાપરી નાખવાનું વિધાન પૂર્વકળમાં હતું. આખા દિવસની દિનચર્યામાં જાણ્યે- અજાણ્યે જે હિંસા થતી તેમાંથી મુક્ત થવા માટે પણ બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, અતિથિયજ્ઞ અને ભૂતયજ્ઞ વગેરે પાંચ મહાયજ્ઞોનું વિધાન પહેલાના કળમાં હતું. આ બધી વાતોથી એ જાણી શકય છે કે જીવવા માટે અનિવાર્યપણે કરાતાં કર્યોમાં પણ જે હિંસા થતી તે માટે પણ લોકોના મનમાં કેટલી બધી પસ્તાવાની લાગણી હતી. જ્યાં સુધી અશાંતિના મૂળમાં પાણી રેડતા રહીએ અને માત્ર ડાળાંપાંખળાં જ કાપતા રહીએ ત્યાં સુધી અશાંતિ જાય ક્યાંથી?

આટાટલા પ્રયત્નો છતાં જો ભૌતિક શાંતિ પણ હાથમાં ન આવતી હોય તો સાચી-તાત્ત્વિક-આધ્યાત્મિક શાંતિની તો આશા જ ક્યાંથી રાખી

શકય? યોગજિજ્ઞાસુ, યોગસાધનાનો પ્રારંભ કરતાંની સાથે જ ભૌતિક શાંતિનો અનુભવ કરવા લાગે છે, કરણ કે યોગસાધનાનાં અંગઉપાંગોનું પાલન જ, પાલન કરનારને શાંતિજલથી નવડાવી દે છે. યમનિયમના પાલન વિના આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિમાં પ્રવેશી શકતું નથી. અહિંસા, સત્ય અચૌર્ય, બ્રહ્મચર્ય અને અસંગ્રહને ‘ધમ’ કહે છે., તથા પવિત્રતા, સંતોષ, તપ સ્વાધ્યાય અને ઈશ્વરશરણાગતિને ‘નિયમ’ કહે છે.

વિશ્વશાંતિના પ્રયત્નો કરવા છતાં પણ જો નિષ્ફળ જવાશે તો સર્વનો સંહાર નિશ્ચિત જ છે. પરંતુ વિશ્વશાંતિનો પ્રયત્ન કરનારાઓને એટલો તો સંતોષ, એટલી તો તૃપ્તિ જરૂર હશે કે “અમે પ્રયત્ન તો કર્યો હતો.”

સત્યનું આચરણ ભલે ક્રિઠિન હશે પણ સફળતા તો સત્યાચરણને જ વરેલી છે. જે પદ્ધતિ સફળતા આપી શકે છે તે ભલે ગમે તેટલી ક્રિઠિન હોય તો પણ તેને સફળતાની તુલનામાં ક્રિઠિન ન કહી શક્ય. સાચી પદ્ધતિને આચરણમાં મૂકવા જેટલા આપણે સમર્થ ન હોઈએ તેથી કંઈ સાચી પદ્ધતિને વખોડી કઢાય નહીં કે તેના તરફ દુર્લક્ષ સેવાય નહીં સાચી પદ્ધતિનું પ્રાપ્ત થવું તે સફળતાનું પ્રથમ ચરણ છે અને તેનો પોતાના મનમાં “સત્ય તરીકે સ્વીકાર થવો” તે સફળતાનું ચરણ છે

ઓમ્ પરિવારના ઉત્સવ - ગુરુપૂર્ણિમા

ક્યા પ્રસંગ નિભિતે	સ્થળ	તારીખ/સમય
ગુરુપૂર્ણિમા	ક્રમેશ્વર મહાદેવ હોલ, અંકુર ચાર રસ્તા, નારણપુરા, અમદાવાદ- ૩૮૦૦૧૩.	૭-૭-૦૮ મંગળવાર સવારે ૮ થી ૧૨

ઓમ્ પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પ્રકાશનો :

૩-બ, પલિયનગર સોસાયટી, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (INDIA) ફોન: ૨૭૮૧૧૧૭૫

Email ID: aumparivar@yahoo.com

ગુજરાતી

	રૂ. પૈસા
૧. ગુરુમહિમા (યોગરહસ્યોથી ભરપૂર) (બીજી આવૃત્તિ)...	૫૫.૦૦
૨. મુક્તા (પાતંજલ યોગદર્શન-સમાધિપાદ) (બીજી આવૃત્તિ)...	૩૮.૦૦
૩. શાંતા (પાતંજલ યોગદર્શન-સાધનપાદ)...	૫૦.૦૦
૪. મારા ગુરુદેવ (જીવન અને સાધનાની અનુભૂતિ)...	૧૫.૦૦
૫. ઈશ્વરની ઓળખ (ઈશ્વર કોને કહી શક્ય?) ઓમ્ વિષેની વિસ્તૃત માહિતી (ત્રીજી આવૃત્તિ) ...	૦૮.૦૦
૬. મંત્રવિજ્ઞાન અને ધ્યાન...	૨૦.૦૦
૭. સત્સંગ-પરાગ...	૦૨.૦૦
૮. નિર્જર ઝર્યું કો ગેબથી (વિશ્વઅશાંતિ અતિ ગુપ્ત કારણોની મૌલિક રજૂઆત. (બીજી આવૃત્તિ) ...	૧૫.૦૦
૯. કિસકો લાગુ પાય? ...	૦૫.૦૦
૧૦. સ્વાધ્યાય (ત્રીજી આવૃત્તિ) ...	૧૦.૦૦
૧૧. મારે સમાજને બેઠો કરવો છે. (બીજી આવૃત્તિ) ...	૦૮.૦૦
૧૨. પ્રેરણાસિધ્ધ (બીજી આવૃત્તિ) ...	૨૦.૦૦
૧૩. પ્રેરણાપીયુધ (શ્રી ગુરુપ્રેમભિક્ષુજ્ઞાના પ્રેરણાધ્યાધી પત્રો) ...	૦૮.૦૦
૧૪. કડવું અમૃત (બીજી આવૃત્તિ) ...	૪૦.૦૦
૧૫. મૂત્રસંજીવની...	૩૪.૦૦
૧૬. વિજળીના જબકરે...	૬૦.૦૦
૧૭. આધ્યાત્મિક ગરબા (કંતિકારી તળપદી) ...	૧૫.૦૦
૧૮. ઓમ્નારાયણના ચિત્રો (મોટા) ...	૦૫.૦૦
૧૯. ઓમ્નારાયણના ચિત્રો (નાના) ...	૦૩.૦૦

સુતમ્ભરા (ત્રિમાસિક) લવાજમ: વાર્ષિક રૂ.૩૦.૦૦, આજીવન રૂ.૫૦૦.૦૦

દિની

૧. નિર્જર ઝરા કો ગેબસે (વિશ્વઅશાંતિના અતિ ગુપ્ત કારણોની મૌલિક રજૂઆત)...	૧૦.૦૦
૨. ઈશ્વરકી પહ્યાન (ઓમ્ વિષેની વિસ્તૃત માહિતી- પાતંજલ યોગદર્શન-સમાધિપાદના સૂત્ર ૨૪ થી ૨૮)	૧૧.૦૦
૩. કંતનિયંત્રન (પૂ. યોગભિક્ષુજ્ઞ અને ઓ.પ્રે.પ.ટ્રસ્ટનો પરિચય) ...	૧૭.૦૦
૪. મુક્તા (પાતંજલ યોગદર્શન-સમાધિપાદ) ...	૫૫.૦૦

English

૧. Maitri (The Yoga-secret of Universal Peace) ...	૨.૫૦
૨. Streaming from The invisible (The subtlest causes of world unrest) ...	૭.૦૦
૩. Easiest is Realization (Articles) ...	૫.૦૦
૪. Why Meditation? ...	૩.૦૦
૫. Yogabhikshu & An Introduction...	૫.૦૦
૬. I wish to Awaken The Society...	૧૦.૦૦

ઓડિયો ટેક્સેટ - સીરી

૧. સંગીતમય ગાયત્રી મંત્ર... ...	૩૫.૦૦	૫. ભજનો (સાદુ સંગીત) ...	૩૫.૦૦
૨. પૂ. યોગભિક્ષુજ્ઞના પ્રવચનો... ...	૩૫.૦૦	૬. ઓમ્ ચાલીસા... ...	૪૦.૦૦
૩. અલોકિક કંતિકારી ગરબા... ...	૩૫.૦૦	૭. ગુરુ બાવની તથા ભજનો... ...	૩૫.૦૦
૪. સ્વાધ્યાય (ઓમ્ પરિવાર)	૩૫.૦૦	૮. ગુરુ બાવની તથા ભજનો (સીરી)... ...	૩૫.૦૦